

## FAQS

(૧) મે PTC કોર્ષ કરેલ છે તો હું આંગણવાડી કાર્યકરનું Form ભરી શકું?

- હા, આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત PTC/Pre-PTC /B.Ed અથવા તો ધો-૧૨ પછીનો કોઈપણ ડીપ્લોમા કોર્ષ અથવા સ્નાતક કોર્ષ વિગેરે કોર્ષ માટે ગુણભાર આપેલ છે. જેમા આપ આપની પસંદગીનો કોઈપણ કોર્ષ દેખાડી દાવેદારી કરી શકો છો.

(૨) મારે ધોરણ - ૧૨ પાસની માર્કશીટ ખોવાઈ ગયેલ છે તો ઝેરોક્ષ અપલોડ કરી શકું?

- ના.

(૩) અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરીણામ જાહેર થયું નથી, તો શું હું Form ભરી શકું?

- ના, ઉમેદવારની પસંદગી મેરીટ આધારીત હોય માર્કશીટ જરૂરી છે. તથા અરજી કરવાની છેલ્લી તારીખ અન્ય કટ ઓફ ડેટ ગણવામાં આવે છે તથા આ તારીખે ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડો પૂર્ણ થયેલ હોવા જોઈએ.

(૪) અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે, તો તે અપલોડ કરું તો મેરીટમાં માન્ય ગણાશે?

- ના, સરકારશ્રી દ્વારા નિયત થયેલ અધિકારીશ્રીનો દાખલો જોઈએ.

(૫) રહેઠાણનાં પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ/ રેશનકાર્ડ/ તલાટી - કમ - મંત્રીનો દાખલો છે. એ માન્ય રહેશે?

- ના, મહિલા અને બાળ વિકાસ નાં ઠરાવ અનુસાર સંબંધિત મામલતદારશ્રી દ્વારા ઈસ્યુ થયેલ દાખલો જ માન્ય ગણાશે.

(૬) મેં કોલેજનાં બે વર્ષ પુર્ણ કરેલ છે/ પાસ છું પરંતુ ત્રીજા વર્ષ પુર્ણ કરેલ નથી/નાપાસ છું. તો તે બે વર્ષના માર્ક ઉમેરી શકું?

- ના, માત્ર સફળતા પુર્વક પુર્ણ કરેલ ડીગ્રી/ કોર્ષની વિગત જ ઉમેરવાની છે.

(૭) જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતાં અન્ય આંગણવાડીમાં હું તેડાગર તરીકે ફરજ બજાવું છું, તો મને પહેલા પસંદગી/અગ્રતાનો લાભ મળશે?

- ના, તા. ૨૫/૧૧/૨૦૧૯નાં મ.બા.વિ. ઠરાવનાં નિયમ નં. - ૬ (૬.૧ થી ૬.૬) થી સમાન આંગણવાડીમાં ફરજ બજાવતાં તેમજ ઠરાવની તમામ શરતોને આધીન જ અગ્રતાનો લાભ મળે છે.

(૮) જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી વિસ્તારમાં હું બે વર્ષથી જ રહું છું તો હું Form ભરી શકું?

- હા, ફોર્મ ભરી શકશો અને આ અંગેનો નિયતનમુનામાં રહેઠાણ અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે.

(૯) જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં હું તેડાગર તરીકે ૧૨ વર્ષથી ફરજ બજાઉં છું તથા આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવું છું પરંતુ મારી ઉંમર ૪૦ વર્ષ છે તો મને લાભ મળશે?

- ઠરાવમાં દર્શાવેલ તમામ શરતો પરિપૂર્ણ થતી હશે તો લાભ મળી શકશે.

(૧૦) જન્મ તારીખનાં પુરાવા માટે કયા - કયા આધાર માન્ય રહેશે?

- જન્મ તારીખનો દાખલો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- ધોરણ ૧૦ નું કેડીટ સર્ટીફિકેટ

(૧૧) જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં મારા સાસુ તેડાગર તરીકે ફરજ બજાવે છે. તો શું હું અરજી કરી શકું?

- ના, મ.બા.વિના તા. ૨૫/૧૧/૨૦૧૯ ના ઠરાવનાં શરત નં. - ૪.૪ નિયમોનુસાર તમે અરજી કરી શકશો નહીં.

(૧૨) જો મારી ઓનલાઇન અરજી વાંધા(અગ્રાહ્ય થયેલ) હોય તો સ્કુટીની પછી મને સુધારવાનો મોકો મળી શકે છે?

- ના. ક્ષતિ સુધારવાની તક મળશે નહિ.

(૧૩) આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઇન અરજીમાં અરજદાર બી.એડનો કોર્સ સ્નાતક કોર્સ પાસની વિગતમાં દર્શાવી શકાય?

- હા, આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત PTC/Pre-PTC /B.Ed અથવા તો ધો-૧૨ પછીનો કોઈપણ ડીપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ વિગેરે કોર્સ માટે ગુણભાર આપેલ છે.

(૧૪) માનદસેવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખ પહેલાનાં કેટલા સમયનું પહેલાનું પ્રમાણપત્ર માન્ય રહેશે?

- વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખ પહેલાનાં છ માસથી વધારે સમય પહેલા ઇસ્યુ થયેલ ન હોય તેવું પ્રમાણપત્ર માન્ય રહેશે.

(૧૫) અરજદાર અરજી કરવા સમયે કોઈ પણ સ્થાનિક સ્વરાજ સંસ્થા/ વિધાનસભા/ લોકસભા અથવા કોઈ પણ સરકારી સંસ્થા/ રજિસ્ટર્ડ સોસાયટી/ રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચુંટાયેલ પદ ધરાવતા હોય અને છોડવા માંગતા ન હોય તો આંગણવાડીમાં કાર્યકર/ તેડાગર તરીકે પદ ધારણ કરવા અરજી કરી શકે?

- ઠરાવની શરત ક્ર.૪.૫ મુજબ આ અયોગ્યતા છે.

(૧૬) અરજદારે માર્કશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) હોય તે કિસ્સામાં કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

- આ કિસ્સામાં અરજદારે યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારી નું પ્રમાણપત્ર/માર્કશીટ મેળવવાનું રહેશે તથા તેને અપલોડ કરવાનું રહેશે. આ ઉપરાંત એ મુજબ માર્ક્સ/ટકાવારી અરજી ફોર્મમાં દર્શાવવાની રહેશે.

(૧૭) નિમણુક હુકમ મળ્યાથી કેટલા સમયમાં ફરજ પર જોડાવવાનું રહેશે?

- નિમણુક હુકમ મળ્યાથી દિન-૧૦માં ફરજ પર હાજર થવાનું રહેશે.

(૧૮) મેરીટ જાહેર થયા બાદ મેરીટ બાબતે કોઈ ફરીયાદ /અપીલ હોય તો અરજદાર કેવી રીતે કરી શકે?

- આ બાબતે ઓનલાઇન મેરીટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરીટ યાદી અંગે અપીલ/રજૂઆત/ફરીયાદ મેરીટ જાહેર થયાથી ૧૦ દિવસની મુદત દરમિયાન ઓનલાઇન પધ્ધતિ દાખલ કરી શકશે.

(૧૯) જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ને પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં માર્ક્સ/ટકાવારી ઓનલાઇન અરજીમાં કેવી રીતે દર્શાવવાની રહેશે.?

- એક થી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારી જે તે માર્કશીટમાં પાસ થયેલ વિષય/વિષયના ગુણ જ ગણવાના રહેશે. ત્યારબાદ નાપાસ થયેલ વિષયના કિસ્સામાં ફરીથી પાસ થયેલ વિષય/વિષયોના ગુણ ગણવા.

(૨૦) અરજદારે પ્રમાણપત્રો અપલોડ કરવામાં શું ધ્યાન રાખવું ?

- પ્રમાણપત્રો અસલ નકલમાં, કલર સ્કેન કરી, પી.ડી.એફ. ફોર્મેટમાં સ્કેન કરવાના રહેશે. આ બાબતે દરેક પ્રમાણપત્રની સાઇઝ ૨ (MB) થી વધારે હોવી જોઈએ નહીં.

ઉપરોક્ત પ્રશ્નોત્તરી ઉમેદવારના અરજી ફોર્મ ભરવા બાબત માર્ગદર્શન હેતુ બહાર પાડવામાં આવેલ છે. આ બાબતે કોઈ પણ અંતીત અર્થઘટન મ.બા.વિ.ન. ઠરાવ ક્રમાંક આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ(પાર્ટ-૨) તા.૨૫/૧૧/૨૦૧૯ તથા તેમના વખતો વખતના સુધારાને આધીન રહેશે.